

Flipkart's Big End of Season Sale 2024

Ahmedabad, Flipkart, India's homegrown e-commerce marketplace, has announced its much-anticipated 'Big End of Season Sale' (Big EOSS) beginning 1st June 2024. With the stage set to be one of the largest celebrations of fashion, the Big EOSS will offer customers a wide range of trendy styles, premium brands and exciting offers, featuring curated 'SPO!' delivered to every serviceable pin code PAN India. The Flipkart Big EOSS 2024 will offer choices from over 12,000 brands and 2 Lakh+ sellers, with the option of open-box delivery across categories like sports shoes, watches and jeans. Same-day delivery will be available on over 1 lakh products. Some of the popular choices include styles from Puma, Adidas, Nike, Tommy Hilfer, Fossil, Titan, Crocs, UCB, Vera Moda, Only, W, USA, Arroyo, American Tourister, Peter England, to name a few among the wide selection of brands available on Flipkart. (22-2)

Mothers Unite on World No Tobacco Day and Pledge to Protect Children

Ahmedabad, In line with the WHO (World Health Organisation) World No Tobacco Day 2024 theme of 'Protecting Children from Tobacco', Mothers Against Vaping, a united front of concerned mothers combating the escalating vaping crisis among our youth, today organized an event in the Indian International Centre, New Delhi. In the event titled 'Saving the Next Generation from New-Age Addictions', Mothers from various walks of life united under Mothers Against Vaping and pledged to protect children from the global tobacco industry's interference. Kushboo Sundar, Actress and Politician, a special invitee of BJP National Executive Committee and a member of the National Commission for Women and Kishwar Desai, Author and Columnist, joined Mothers Against Vaping and bolstered the cause. They join a distinguished group of leading sports icons and influential role models like Baichung Bhatia, Deepa Malik and Neha Singh with Mothers Against Vaping in their efforts to eradicate the menace of vaping from the lives of children. The strong support from these diverse personalities highlights the gravity of the issue tackled by Mothers Against Vaping, affirming its recognition as a critical concern. (22-2)

Ujjivan Small Finance Bank launches an innovative campaign

Ahmedabad, Ujjivan Small Finance Bank (Ujjivan SFB), a leading small finance bank in India, has launched a unique initiative on 'World No Tobacco Day' to drive awareness amongst individuals to make healthier financial choices. Our initiative is to catch people's attention when they are least expecting and make them think. To ensure that the message reaches the right audience, Ujjivan SFB will distribute creatively designed lookalike cigarette boxes in high footfall smoking zones, such as around corporate offices, malls, nudkads etc. Each cigarette pack is designed with the desired 'Healthy habit to save more'. Additionally, the cards within the boxes will encourage people to explore options like opening savings and fixed deposit at an attractive interest rate, for better financial health. Commenting on the initiative Mr. Lakshman Velayutham (Chief Marketing Officer, Ujjivan SFB) said, "The 'World No Tobacco Day', initiative is about presenting people with a choice to people. While they are aware, we are trying to serve a reminder with choices that they could possibly make. We believe our messages on 'Savings Habit' and 'Wealth Creation', without stepping in their personal choice, will have the desired positive impact". (13-9)

IDFC FIRST Bank - Preferential issue of 3,200 crore

Ahmedabad, IDFC FIRST Bank has laid a robust foundation with a strong and profitable business model. The Bank is seeing strong traction in raising deposits with customer deposits growing by 42% in FY24 over FY23. The Bank also sees significant upcoming opportunities for loan growth with high asset quality. The overall asset quality of the Bank continues to be good, with NPA of 1.88% and NPA of 0.60% as of March 31, 2024. In the retail, rural and semi finance book, the Gross and Net NPA continues to be quite low at 1.38% and 0.44% respectively as of March 31, 2024. The Bank is also well positioned in terms of experience, team, technology, systems, risk management and controls, to take advantage of the growth opportunities in a stable manner. The business is also profitable with the profit after tax increasing to ₹ 2,957 crores in FY24, an increase of 21% over ₹ 2,437 crores in FY23. The capital adequacy as of March 31, 2024 is strong at 16.11%. With the objective to take advantage of upcoming growth opportunities, the Bank intends to raise funds of ₹ 3,200 crores by issuing equity shares of ₹ 100 each on a preferential basis. With this proposed capital raise of ₹ 3,200 crores, the overall capital adequacy of the Bank will further increase to 17.49%, as computed on the risk weighted assets as on March 31, 2024 which will put the bank in a strong position to participate in future growth. (19-10)

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLICATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chamber, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLICATION PVT. LTD. 201, 202, 208 Nandan complex, opp bhikhakhali fly crossing, mithakhali, ahmedabad. Editor : Mayur C. Bhatt

Decoding Samsung 'Solve for Tomorrow'

Ahmedabad, Samsung's 'Solve for Tomorrow' serves as a platform that enables the convergence of innovative concepts that help in finding solutions for some of the most pressing global issues. This initiative transcends theory, extending an invitation to young innovators to lead and collaborate in building a sustainable future. The 'Solve for Tomorrow' platform recognizes the importance of harnessing innovation for yielding advancements. A World of Possibilities: Imagine a realm where every idea, big or small, holds the potential to shape a greener, more sustainable and an inclusive future empowering the communities. The two distinct tracks - School Track and Youth Track, each are dedicated to championing a specific theme and are targeted towards different age groups. Both the tracks will run simultaneously, ensuring equal opportunity and a level playing field for all students. Enter Samsung's 'Solve for Tomorrow'-a platform where innovation meets real-world challenges head-on. Where Innovation Meets Action: 'Solve for Tomorrow' isn't just about dreaming; it's about turning those dreams into reality. Young minds are encouraged to convert innovative concepts into practical solutions for a better tomorrow. Empowering the Next Generation: From regulating body temperature with semiconductor devices to combating gender biases through AI, the sky is the limit for participants. This initiative empowers young innovators to lead the charge towards sustainability, and social causes like education, healthcare, diversity and inclusion. The Journey Begins: It all starts with a simple registration at Samsung Solve for Tomorrow 2024. Whether in school or college, participants bring their passion and creativity to the table to tackle pressing environmental issues. (20-4)

HERO MOTOCORP LAUNCHES THE LATEST GENERATION SPLENDOR+

Ahmedabad, Hero MotoCorp, the world's largest manufacturer of motorcycles and scooters, has launched the latest generation of the iconic Splendor - the Splendor+ XTEC 2.0 - to celebrating the 30th anniversary of the world's best-selling motorcycle. This premium and tech-laden Splendor keeps its iconic design while integrating modern elements such as LED headlights with HIPL (High Intensity Position Lamp), a unique H-shaped signature tail lamp that gives it a distinctive appearance and multiple convenience & safety features. Showcasing its all-around dominance, the motorcycle boasts excellent fuel efficiency of 73 kmpl. The Splendor+ XTEC 2.0 includes a digital speedometer with Eco-Indicator for better fuel efficiency, RTMI (Real Time Mileage Indicator), Bluetooth connectivity for call and SMS alerts, and hazard lights for enhanced safety. Additionally, the longer seat offers increased comfort, while a larger glove box with a hinge-type design provides added convenience for riders. The bike offers an exclusive feel and is instantly recognizable through its dual-tone colour theme. (20-4)

MAGGI inspires change with first-of-its-kind edible fork

Ahmedabad, MAGGI's 'Deshkelye 2 minute' initiative, launched in 2020, aims to create a significant impact through small actions. One of its goals is to offer sustainable alternatives to single-use plastic. In line with this objective, MAGGI has introduced an edible fork in partnership with Nestlé R&D India (a subsidiary of Nestlé S.A and a part of Nestlé's global R&D network) and an Indian start-up Trishula. Made from wheat flour, this innovative fork enhances the delightful experience of savoring MAGGI Cuppa Noodles, adding to its soupy, slurpy, and mesalee charm. Earlier in 2023, MAGGI also launched foldable, compostable forks in India which was jointly developed in collaboration with Nestlé's Institute of Packaging Sciences in Lausanne, Switzerland, Kaneka India Pvt.Ltd., and Nestlé India R&D. The introduction of the foldable, compostable forks could result in annualised plastic reduction of approximately 35 MT. Commenting on the test launch of the edible forks, Mr. Rajat Jain, Director, Foods, Nestlé India, said "At Nestlé, it is our continuous endeavor to discover ways to build a better future for our consumers and the planet. The launch of edible fork in Cuppa noodles marks a significant milestone in our commitment towards environmental responsibility while pioneering consumer-centric initiatives. (20-4)

Bharti Airtel appoints Sharat Sinha as CEO of Airtel Business

Ahmedabad, Bharti Airtel ("Airtel"), India's leading telecommunications services provider has appointed Sharat Sinha as the CEO of Airtel Business effective 3rd June 2024. In this role, Sharat will report to Gopal Vittal and will be a part of the Airtel Management Board. Sharat joins Airtel Business from Checkpoint Software Technologies Limited, where he served as President of Asia Pacific. A seasoned technology professional, Sharat has also worked with Palo Alto Networks, Cisco, and VM Ware in various leadership roles. His early experiences in Ericsson and VSNL have also given him a sound telecom background. Announcing the appointment, Gopal Vittal, CEO and MD of Bharti Airtel said, "I am confident that Sharat's broad global experience in product management and business leadership across many of the world's leading technology companies will provide tremendous fire power to Airtel's ambitions in rapidly growing our portfolio across connectivity and adjacencies". On his appointment to Airtel Business, Sharat Sinha said "Airtel Business is a leader in the B2B space offering marquee solutions to enterprises and I am delighted to join this passionate team as they continue to steer towards enhancing their leadership with future-ready technology innovations and solutions that deliver greater value to customers". (13-9)

Marengo CIMS Hospital Ahmedabad, celebrates this year's WHO theme of advocacy of protecting children from tobacco



Ahmedabad, Marengo CIMS Hospital announces its proactive participation in the global observance of World No Tobacco Day on May 31st, 2024. The hospital in aligning its initiatives with the theme designated by the World Health Organization (WHO), 'Protecting children from tobacco industry interference', spreads awareness on the tobacco epidemic and preventable death and diseases tobacco causes. The 2024 theme

of WNTD 2024 is focused on advocating for an end to the targeting of youth with harmful tobacco products. In alignment with the WHO's global campaign, Marengo CIMS Hospital commenced the day with educational TV Talk Shows featuring renowned cancer surgeons and experts in the field of tobacco control. These discussions delved into the various health risks associated with tobacco use especially in children, including its detrimental effects on respiratory health, overall well-being. It emphasized the importance of cessation programs and offered guidance on how individuals can quit smoking or chewing tobacco. Dr. Darshan Bhanjali, Sr Surgeon for Head & Neck Cancer, Marengo CIMS Hospital says, "The 'World No Tobacco Day' serves as a crucial reminder of the urgent need to address this global epidemic. (16-2)

JHAVERI JHAVERI CREDITS AND CAPITAL LIMITED
 CIN: L65910GJ1993PLC020371
 Regd. Office : B-2, 907-912, Palladium, B/h. Divya Bhaskar Press, Prahladnagar, Nr. Vodafone House, Ahmedabad - 380015
 Phone : +91 971200637 | Website: www.jhavericredits.com | E-mail: cs@jhavericredits@gmail.com

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024
 (Rs. in lakhs, except per share data)

Particulars	Quarter ended		Year Ended	
	31/03/2024	31/03/2023	31/03/2024	31/03/2023
Revenue from Operations	490.63	1132.22	2619.62	1161.99
Profit before exceptional items and tax	97.96	92.28	259.10	81.94
Profit before tax	97.96	92.28	259.10	81.94
Profit for the period	35.06	93.14	161.03	78.56
Total Comprehensive Income (after tax)	0.00	0.00	0.00	0.00
Paid up Equity Share Capital (of Rs. 10 each)	898.59	646.33	898.59	646.33
Other Equity excluding revaluation reserve				
Earnings per equity share (of Rs. 10 each)				
Basic (Not Annualised)	0.39	1.44	2.42	1.22
Diluted (Not Annualised)	0.39	0.00	0.00	1.22

Notes:
 1. The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above results at their respective meetings held on May 30, 2024.
 2. The above is an extract of the detailed format of the audited financial results for the quarter and year ended on March 31, 2024 filed with the Stock Exchange pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
 3. The full format of the audited financial results for the quarter and year ended on March 31, 2024 are available on the Stock Exchange's website (www.bseindia.com) and the Company's website www.jhavericredits.com.
For Jhaveri Credits and Capital Limited
 Sd/-
Vishvukumar Patel
 Managing Director
Date : Ahmedabad
Place : May 30, 2024

WESTERN RAILWAY - VADODRA DIVISION
ENGINEERING WORK
e-TENDER NOTICE NO. DRM BRCC 044 OF 2024-25

Sealed tenders for and on behalf of the President of India are invited by Divisional Railway Manager (W.A.C.) Western Railway, Pratappanagar, Vadodra-390 004 for the following works. Sr. No.1: Tender No. DRM BRCC 044 of 2024-25. Name of Work: Supply and execution of Rail Welds with Contractor's own welding materials, labor etc for various track renewal works under jurisdiction of DM N BRCC. (Re-invited) (R-2). Approximate Cost of the work (in ₹): 21,07,108.21. Bid Security to be deposited (in ₹): 2,60,900.00. Date and time for submission of tender and opening of tender: Tender is to be submitted on 19-06-2024 before 15:00 Hrs. and is to be opened on same date at 15:30 hrs. Website particulars and notice for location where complete details can be seen & Address of the office from where tender form can be purchased: Website @ www.irps.gov.in. Divisional Railway Manager (W.A.C.), Western Railway, Pratappanagar, Vadodra-4.

Like us on f | facebook.com/WesternRly

MAITRI ENTERPRISES LIMITED
 CIN: L45208GJ1991PLC016853
 Registered Office: "Gayatri House", Ashok Vihar, Near Maitri Avenue Society, Opp. Government College, Motera, Sabarmati, Ahmedabad-380005, Gujarat, E-mail id : compliance@maitrienterprises.com, Phone : 079-275 06840/27571340, website : www.maitrienterprises.com

EXTRACT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024
 (Rs. in Lakhs except Earning per share data)

Particulars	Quarter Ended		Year Ended	
	3 MONTHS ENDED March 31, 2024	3 MONTHS ENDED December 31, 2023	3 MONTHS ENDED March 31, 2023	FOR THE YEAR ENDED March 31, 2023
Total income from operations (net)	633.11	611.98	407.88	1914.15
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(61.79)	27.57	12.08	(41.69)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(61.79)	27.57	12.08	(41.69)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(46.38)	8.89	7.20	(44.95)
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after Equity Share Capital	440.00	440.00	440.00	440.00
Other Equity excluding Revaluation Reserve			11.89	56.84
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)				
Basic :	(1.05)	0.20	0.16	(1.02)
Diluted:	(1.05)	0.20	0.16	(1.02)

Extract of Standalone Audited Financial Results for the Quarter and Year ended March 31, 2024
 (Rs. in Lakhs except Earning per share data)

Particulars	Quarter Ended		Year Ended	
	3 MONTHS ENDED March 31, 2024	3 MONTHS ENDED December 31, 2023	3 MONTHS ENDED March 31, 2023	FOR THE YEAR ENDED March 31, 2023
Total income from operations	601.71	644.90	348.28	1,861.07
Profit Before Tax	(36.13)	35.85	21.79	11.64
Profit After Tax (After Other Comprehensive Income)	(21.08)	17.17	16.77	8.01

Note: The above is an extract of the detailed format of Audited Financial Results for the Quarter and year ended on March 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter and year ended Financial Results are available on the website of the Company (www.maitrienterprises.com) and on the website of BSE Limited. (www.bseindia.com)

Sd/-
MR. JAIKISHAN R. AMBANI
 MANAGING DIRECTOR
DIN: 03592680
Date : May 30, 2024
Place : Ahmedabad

AKASH INFRA-PROJECTS LIMITED
 Reg. Off.: 2 Ground Floor Abhishek Complex, Opp. Hotel Haveli, Sector - 11, Gandhinagar - 382011, Gujarat, India.
 CIN : L45209GJ1999PLC036003, Ph. No. : +91 79 23227006, Website : www.akashinfra.com, Email: info@akashinfra.com

EXTRACT OF STATEMENT OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31.03.2024
 (Rs. in lakhs Except per Share Data)

Sr. No.	Particulars	Standalone				Consolidated					
		Quarter ended		Year Ended		Quarter ended		Year Ended			
		31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2024	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023		
1	Total Income	1,095.72	496.77	1,342.42	5,578.92	6,277.33	1,670.35	542.29	1,344.03	6,202.26	6,283.55
2	Net Profit for the Period (Before Tax, Exceptional and Extraordinary Items)	337.75	-196.00	12.28	75.29	175.07	353.26	-215.94	9.40	59.30	172.79
3	Net Profit for the Period (Before Tax after Exceptional and Extraordinary Items)	337.75	-196.00	12.28	75.29	175.07	353.26	-215.94	9.40	59.30	172.79
4	Net Profit / (Loss) for the period after tax	296.46	-197.02	2.95	34.48	141.39	314.97	-216.90	0.07	18.50	139.11
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	298.06	-196.00	6.39	36.16	145.48	312.48	-212.48	4.56	24.87	145.25
6	Paid-up Equity Share Capital of Face Value Rs.10/- Each	1,686.25	1,686.25	1,686.25	1,686.25	1,686.25	1,686.25	1,686.25	1,686.25	1,686.25	1,686.25
7	Other Equity (Including revaluation reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	-	-	-	6,435.17	6,399.03	-	-	6,693.47	6,666.49	-
8	Earnings Per Equity Share (Not Annualised): Diluted	1.77	-1.16	0.04	0.21	0.86	1.85	-1.26	0.03	0.15	0.86
	Earnings Per Equity Share (Not Annualised): Diluted	1.77	-1.16	0.04	0.21	0.86	1.85	-1.26	0.03	0.15	0.86

Notes:
 1. The above is an extract of the detailed format of Audited Financial Results for the Quarter and year ended on 31.03.2024 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Audited Financial Results for the aforesaid Quarter are available on the Stock Exchange website i.e. www.sebiindia.com and on the website of the Company i.e. www.akashinfra.com
 2. The above results have been reviewed by the Audit Committee of the Directors and approved by the Board of Directors at their meeting held on 30th May, 2024.

For AKASH INFRA-PROJECTS LIMITED
 YOGINUMAR HARIBHAI PATEL
 MANAGING DIRECTOR
DIN : 06653235
Place : Gandhinagar
Date : 30.05.2024